

હવામાન આગાહી આધારીત કૃષિ સલાહ બુલેટીન દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિભાગ

તા. ૨૩-૧૦-૨૦૧૯ થી તા. ૨૭-૧૦-૨૦૧૯

(ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુ.કૃ.યુ.)

હવામાન આગાહી આધારીત બુલેટીન : ૨૦૧૯-૨૦

પાછલા અઠવાડીયાનું જુનાગઢનું હવામાન

હવામાન પરીબળો	દક્ષિણ સૌરાષ્ટ્ર કૃષિ આબોહવાકીય વિસ્તાર
વરસાદ (મીમી)	૦૦૧.૦
મહત્તમ તાપમાન (°સે.)	૩૫.૩
લઘુત્તમ તાપમાન (°સે.)	૨૩.૧
ભેજ(%) (સવાર/બપોરબાદ)	૭૮ - ૪૮
પવનની ગતિ (કિમી/કલાક)	૦૨.૭

પત્રક-બ : જીલ્લાવાર હવામાન આગાહી (તા.૨૭-૧૦-૨૦૧૯ સુધી)

ભારત સરકારશ્રીના હવામાન વિભાગ તરફથી મળેલ હવામાન આગાહીની માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ તરફથી જણાવવામા આવે છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના

૧.જુનાગઢ:- જીલ્લામા આગામી તારીખ ૨૩/૧૦/૨૦૧૯ થી ૨૭/૧૦/૨૦૧૯ દરમિયાન આકાશ મુખ્યત્વે આગામી પાંચ દિવસોમાં વાદળછાયું રહેશે, આવતી કાલે હળવા વરસાદ ની શક્યતાઓ છે જ્યારે બાકીના દિવસોમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. પવનની ઝડપ ૦૯ થી ૧૮ કીમી/કલાક રહેવાની શક્યતા રહેશે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન ૩૪ થી ૩૫ ડીગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેમજ લઘુત્તમ તાપમાન ૨૩ થી ૨૪ ડીગ્રી સેન્ટીગ્રેડ રહેવાની સંભાવના છે.

૨.પોરબંદર:- જીલ્લામા આગામી તારીખ ૨૩/૧૦/૨૦૧૯ થી ૨૭/૧૦/૨૦૧૯ દરમિયાન આકાશ મુખ્યત્વે આગામી પાંચ દિવસોમાં મોટેભાગે વાદળછાયું થી વાદળછાયું રહેશે, આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદ ની શક્યતાઓ નથી. પવનની ઝડપ ૦૬ થી ૨૨ કીમી/કલાક રહેવાની શક્યતા રહેશે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેમજ લઘુત્તમ તાપમાન ૨૩ થી ૨૪ ડીગ્રી સેન્ટીગ્રેડ રહેવાની સંભાવના છે.

૨.ગીર સોમનાથ:- જીલ્લામા આગામી તારીખ ૨૩/૧૦/૨૦૧૯ થી ૨૭/૧૦/૨૦૧૯ દરમ્યાન આકાશ મુખ્યત્વે આગામી પાંચ દિવસોમાં વાદળછાયું રહેશે, આવતી કાલે હળવા વરસાદ ની શક્યતાઓ છે જયારે બાકીના દિવસોમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. પવનની ઝડપ ૧૧ થી ૨૩ કીમી/કલાક રહેવાની શક્યતા રહેશે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન ૩૨ થી ૩૪ ડીગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેમજ લઘુત્તમ તાપમાન ૨૩ થી ૨૬ ડીગ્રી સેન્ટીગ્રેડ રહેવાની સંભાવના છે.

જુનાગઢ

હવામાન પરીબળો / તારીખ	દિવસ-૧ ૨૩-૧૦-૨૦૧૯	દિવસ-૨ ૨૪-૧૦-૨૦૧૯	દિવસ-૩ ૨૫-૧૦-૨૦૧૯	દિવસ-૪ ૨૬-૧૦-૨૦૧૯	દિવસ-૫ ૨૭-૧૦-૨૦૧૯
વરસાદ (મી.મી)	૧૦	૦૦	૦૦	૦૦	૦૦
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	૩૪	૩૪	૩૫	૩૫	૩૫
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	૨૪	૨૪	૨૪	૨૩	૨૩
વાદળની સ્થિતિ	વાદળછાયું	વાદળછાયું	વાદળછાયું	વાદળછાયું	વાદળછાયું
સવારના ભેજના ટકા	૭૮	૭૪	૬૨	૪૮	૫૬
બપોર બાદ ભેજના ટકા	૫૮	૪૮	૩૮	૨૮	૨૯
પવનની ગતિ (કિમી/કલાક)	૦૦૯	૦૧૮	૦૧૭	૦૧૬	૦૧૮
પવનની દિશા (ડીગ્રી)	૪૭	૪૩	૩૭	૫૦	૫૫

પોરબંદર

વરસાદ (મી.મી)	૦૦	૦૦	૦૦	૦૦	૦૦
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	૩૩	૩૩	૩૩	૩૩	૩૩
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	૨૪	૨૪	૨૩	૨૩	૨૩
વાદળની સ્થિતિ	વાદળછાયું	વાદળછાયું	મોટેભાગે વાદળછાયું	વાદળછાયું	મોટેભાગે વાદળછાયું
સવારના ભેજના ટકા	૭૭	૬૮	૫૨	૪૪	૪૮
બપોર બાદ ભેજના ટકા	૫૩	૪૨	૩૧	૨૯	૩૧
પવનની ગતિ (કિમી/કલાક)	૦૦૬	૦૧૭	૦૧૬	૦૧૫	૦૨૨
પવનની દિશા (ડીગ્રી)	૯૪	૪૩	૪૩	૪૬	૬૪

ગીર સોમનાથ

વરસાદ (મી.મી)	૦૮	૦૦	૦૦	૦૦	૦૦
મહત્તમ તાપમાન (સે.ગ્રે)	૩૨	૩૩	૩૪	૩૪	૩૪
લઘુત્તમ તાપમાન (સે.ગ્રે)	૨૬	૨૫	૨૪	૨૩	૨૩
વાદળની સ્થિતિ	વાદળછાયું	વાદળછાયું	વાદળછાયું	વાદળછાયું	વાદળછાયું
સવારના ભેજના ટકા	૭૭	૭૫	૬૬	૫૦	૫૯
બપોર બાદ ભેજના ટકા	૬૮	૫૭	૪૬	૩૮	૩૯
પવનની ગતિ (કિમી/કલાક)	૦૧૧	૦૨૩	૦૨૨	૦૨૧	૦૨૨
પવનની દિશા (ડિગ્રી)	૫૧	૪૬	૩૭	૪૯	૫૮

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકિય વિભાગ

પાકનું નામ	પાક અવસ્થા	રોગ / જીવાત / જાત	કૃષિ સલાહ
			<ul style="list-style-type: none"> ❖ આગામી પાંચ દિવસોમાં જીલ્લાઓમાં વાતાવરણ મોટેભાગે વાદળછાયું થી વાદળછાયું રહેશે. આવતી કાલના રોજ છુટા છવાયા સ્થળો પર જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં હળવા રસાદ ની સંભાવનાઓ છે જ્યારે પોરબંદર જીલ્લામાં આગામી પાંચ દિવસો દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. ❖ ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે પરિપક્વ થયેલ ચોમાસું પાકોની કાપણી અને લણણી કરીને ખળાની કામગીરી વરસાદની શક્યતાને ધ્યાને રાખીને કરવી. ❖ આગોતરા વાવેતર કરેલ ચોમાસું પાકોની સમયસર કાપણી કરી ને સુરક્ષિત જગ્યા પર સંગ્રહ કરવો. ❖ શિયાળુ પાકોના વાવેતર માટે ખેત આયોજન કરવું તે મુજબ બીયારણ, ખાતર અને દવાનો પુરવઠો મેળવી લેવો અને પીયતની સગવડને ધ્યાનમાં લઈ પાકનું વાવેતર કરવું.
ચોમાસું મગફળી	પરિપક્વ અવસ્થા /	-	❖ મગફળીનો પાક પરીપક્વ થાય એટલે સમયસર કાપણી કરવી.

	કાપણી		
કપાસ	ફૂલ / જીંડવા	યુસીયા જીવાત, ગુલાબી ઈયળ	<ul style="list-style-type: none"> ❖ કપાસના પાકમાં વરાપ થયે આંતરખેડ કરવી અને હાથથી નિદામણ કરવું. ❖ કપાસના પાકમાં સમયસર પાળા ચઢાવવાની કામગીરી પૂર્ણ કરવી. ❖ કપાસમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ખેતરમાં ફેરોમેન ટ્રેપગોઠવી નર કુદાઓનો નાશ કરવો. અથવા ૧૦૦ ગ્રામ બીવેરીયા પાવડર અને ૨૦ મીલી પ્રોફેનોફોસ ને ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ❖ કપાસના પાકમાં થ્રીપ્સ અને લીલા તડતડીયાના નિયંત્રણ માટે ૩.૦ મીલી ફોસ્ફામીડોન અથવા ૧૫ મીલી ડાયમિથોએટ અથવા ૧૫ મીલી મીથાઈલ-ઓ-ડેમેટોન દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ❖ કપાસનો પાક ત્રણ માસનો થાય ત્યારે પુર્તી ખાતરનો હપ્તો હેક્ટરે ૧૬૬.૬ કી.ગ્રા. યુરીયા અથવા ૪૦૦ કી.ગ્રા અમોનીયમ સલ્ફેટ આપવું.
સોયાબીન	કાપણી	-	❖ સોયાબીનનો પાક પરીપકવ થાય એટલે સમયસર કાપણી કરવી.
તલ	કાપણી	-	❖ તલનો પાક પરીપકવ થાય એટલે સમયસર કાપણી કરવી.
એરંડા	વૃદ્ધિ	ઘોડીયા ઈયળ	<ul style="list-style-type: none"> ❖ એરંડામાં ઘોડીયા ઈયળના નિયંત્રણ માટે ૨૦ મીલી ક્વીનાલ્ફોસ (૧.૫ % ભુકી) અથવા ૪૦ ગ્રામ કાર્બારીલ ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ❖ પાકમાં વરાપ થયે આંતરખેડ કરવી અને હાથથી નિદામણ કરવું.
ડુંગળી	વૃદ્ધિ	યુસીયા જીવાત	❖ ડુંગળીમાં થ્રીપ્સના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન ૩ મીલી અથવા ડાયમિથોએટ ૧૦ મીલી અથવા મીથાઈલ-ઓ-ડેમેટોન ૧૦ મીલી ના પ્રવાહીને ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦ થી ૧૨ દિવસના અંતરે છંટકાવ કરવા.
અડદ	પરિપકવ અવસ્થા	-	❖ અડદના પાકની પરીપકવ શીંગોની વીણી કરવી.

તુવેર	વૃદ્ધિ	-	<ul style="list-style-type: none"> ❖ પાકમાં વરાપ થયે આંતરખેડ કરવી અને હાથથી નિદામણ કરવું. ❖ પાકમાં સમયસર પાળા ચઢાવવાની કામગીરી પૂર્ણ કરવી.
શાકભાજી	વૃદ્ધી/ફુલ/ ફળ	-	<ul style="list-style-type: none"> ❖ વેલાવાળા શાકભાજીના પાકમાં પાન કોરીયાનો ઉપદ્રવ ટાળવા માટે મુખ્ય પાકની ફરતે દિવેલા તથા ગલગોટાનું વાવેતર કરવાથી તેનું નિયંત્રણ કરી શકાય છે જો ઉપદ્રવ વધુ જોવા મળે તો ૧૦ મીલી મીથાઈલ ઓ ડેમેટોન (૨૫ ઈસી) અથવા ૧૦ મીલી ડાયમીથોએટ (૩૦ ઈસી) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ત્યાર બાદ પછીથી બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો. ❖ શાકભાજીના પાકમાં ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે લીબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીબોળીનું મીજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦મીલી ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો વધુ ઉપદ્રવ હોય તો એસીટામ્રાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ/૧૦લી. અથવા દ્રાયઝોફોસ ૪૦ ટકા ૨૦ મીલી/ ૧૦ લી.પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો. ❖ મરચીના પાકમાં થ્રીપ્સના નિયંત્રણ માટે ૨૦મીલી પ્રોફેનોફોસ અને લિમ્બોળીનું તેલ ૫૦ મીલી ૧૦ લીટર પાણી મિશ્રણ કરી છાંટવી. ❖ શાકભાજીના પાકની રોપણી બાદ ચુસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે દાણાદાર ફોરેટ ૧૦ જી ઓડ દીઠ ૨ ગ્રામ મુજબ આપીને પીયત આપવું. ❖ મરચીના પાકમાં વાઈરસના કારણે પીળા થઈ ફુકડાઈ ગયેલ છોડ ઉપાડી જમીનમાં દાટી નાશ કરવો અને ૫ મીલી ઈમીડાક્લોપ્રાઈડ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ❖ રીંગણ અને ટમેટાના ફળ અને અને ડોકાની ઈયળોનો ઉપદ્રવ જણાય તો નુકશાન પામેલ ફળ અને ડોકાને તોડીને જમીનમાં દાટી દેવા અને રીનાક્ષીપાયર દવા ૩મીલીદવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ❖ રીંગણ અને ટમેટાના પાકમાં ફળમાખીના નિયંત્રણ માટે એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ❖ શાકભાજી ને સમયસર ઉતારી ગ્રેડીંગ કરી બજારમાં મુકવા.

પશુપાલન	-	-	<ul style="list-style-type: none"> ❖ પશુઓને યોગ્ય આહાર આપવો અને પશુઓના રહેઠાણ ચોખ્ખા રાખવા. ❖ માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાટવું. ❖ પશુઓને યોગ્ય આહારમાં ખનિજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારા આપો. ચારા ને સલામત સ્થળે સંગ્રહિત કરવો જોઈએ. ❖ ચારા માટે ચાફ કટર વાપરો. ❖ પશુઓમાં ઈતરડીના નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રીન અથવા એમીટાઝ ૨ મીલી/ ૧ લીટર પાણીમાં નાખીને છાટવી. ❖ દુધાળા પશુઓના આઉને ઝીંક ઓક્સાઈડ અથવા બોરીક પાવડરથી બરાબર સાફ કરવા.
---------	---	---	---

JUNAGADH

Phone: 0285-2670139

Date: - 22-10-2019

Significant weather for the preceding week

Rain fall (mm)	001.0
Maximum temperature °C	35.3
Minimum temperature °C	23.1
RH % (Morning/Afternoon)	78 – 48
Wind speed (Kmph)	02.7
Cloud cover	0

(Period from 23 to 27 October 2019)

Weather forecast for Junagadh Dist. until 08:30 hrs of 27-10-2019

Parameters	Day-1 23-10-19	Day-2 24-10-19	Day-3 25-10-19	Day-4 26-10-19	Day-5 27-10-19
Rain fall (mm)	10	00	00	00	00
Maximum temperature °C	34	34	35	35	35
Minimum temperature °C	24	24	24	23	23
Cloud cover (Okta)	8	8	8	8	8
RH I % (Morning)	78	74	62	48	56

RH II % (After noon)	58	48	38	28	29
Wind speed (Km/h)	009	018	017	016	018
Wind direction(Deg)	47	43	37	50	55

Agro meteorological Advisories

General Advice	Rain fall Temperature RH (%) Wind Direction and Wind Speed		<p>There is forecasting of light rainfall at isolated places during on tomorrow and no rainfall during on next four days.</p> <p>Maximum and minimum temperature likely to be in range of 34 - 35°C and 23 - 24°C, respectively.</p> <p>The Relative Humidity is likely to be in the range of 78 – 28 %.</p> <p>Direction and speed of wind is likely to be mostly NE and 09 - 18 km/h, respectively.</p>
Crop	Variety/ Pest/Insect	Stage	Agro met Advisories
			<ul style="list-style-type: none"> ❖ The sky will remain cloudy during next five days and light rainfall may be occurs during on tomorrow and no rainfall during on next four days. ❖ Farmers are advise to manage their harvesting & threshing of mature Kharif crops as per weather condition. ❖ For pre-sowing of Kharif crops, harvesting operation should be carried out in time & make heap at safe place. ❖ The planning should be done for the sowing

			of <i>rabi</i> crops, procure certified seeds, fertilizers, chemicals and advances.
Kharif Groundnut	-	Pod Maturity / Harvesting	➤ Harvesting operation should be carried out at maturity stage.
Cotton	Sucking pest, Pink bollworm	Flowering / Boll formation	<ul style="list-style-type: none"> ➤ Interculturing and hand weeding should be carried out in cotton. ➤ Earthingup / ridging should be done in time. ➤ Install pink bollworm pheromone traps in the cotton field. OR spray 100 gm Beauveria bassiana powder and 20 ml prophenophos mix in 10 liter of water. ➤ For the control of Thrips and Jassid, spray 3 ml phosphamidon OR 15 ml dimethoate OR 15 ml methyl-O-demeton mix in 10 liter of water. ➤ When the cotton crop is three months, apply the supplementary fertilizer dose is 166.6 Urea kg/ha or 400 kg/ha Ammonium sulphate.
Soyabean	-	Harvesting	➤ Harvesting operation should be carried out at maturity stage.
Seasame	-	Maturity / Harvesting	➤ Harvesting operation should be carried out at maturity stage.
Castor	Semi looper	Vegetative	<ul style="list-style-type: none"> ➤ For the control of castor semi looper, spray 20 ml quinalphos (1.5 % powder) OR 40 gm carbaryl in 10 liter of water. ➤ Interculturing and hand weeding should be carried out in castor.
Onion	-	Vegetative	➤ For the control of thrips, spray Phosphamidon 3.0 ml or Dimethoate 10 ml or Methay-O-Demeton 10 ml in 10 liter of

			water at 10-12 days interval.
Black gram	-	Harvesting	➤ Harvesting operation should be carried out at maturity stage.
Pigeon pea	-	Vegetative	➤ Interculturing and hand weeding should be carried out in pigeon pea. ➤ Earthingup / ridging should be done in time.
Vegetable crops	-	Sowing/ Flowering/ Fruiting	➤ For the control of leaf webber in fruit leafy vegetable, sowing of trap crop (castor and galgota) around the vegetable crop. For the heavy incidence spray 10 ml methyl O demeton (25 EC) Or 10 ml diamethoate (30 EC) in 10 liter of water. ➤ For the control of thrips and white fly, spray neem seed extract 500 ml or neem seed oil 50 or neem oil 40 ml and acetamiprid 20 % SP@ 5.0 gm / 10 lit of water at 15 days interval. ➤ For the control of thrips in chilli, spray 20 ml profenophos in 10 litres of water. ➤ For the control of fruit and shoot borer, spray neem seed extract 5 % or neem seed oil 50 ml and acetamiprid 20 % SP@ 5.0 gm / 10 lit of water at 15 days interval. ➤ Rouging of viral infested crop should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of 5 ml Imidacloprid per 10 litre of water is advised for control the vector, when sky remains clear.

			<ul style="list-style-type: none"> ➤ Apply regular irrigation at 6 to 8 days to the crop at the flowering and fruiting stage. ➤ In brinjal and tomato crops constant monitoring of borers by using pheromone traps 4-6 per acre is advised, for the control of fruit borer, spray reenaxipayar @ 3.0ml in 10 lit of water. ➤ In brinjal and tomato crops, for the control of fruit fly, spray acetemapid 5.0 ml in 10 lit of water. ➤ Keep vegetable crop weed free, apply irrigation regularly and send vegetable fruit to the market often grading.
Livestock	-	-	<ul style="list-style-type: none"> ➤ To provide adequate food and keep the animals clean shed. ➤ Spray phenyl in the animal shed to avoid flies and mosquitoes. ➤ Give stored fodder with mineral mixture. Fodder should be stored at safe place. ➤ Feed silage & hay material along with concentrate feed. ➤ Use chaff cutter for fodder. ➤ For the control of tick and other parasites, spray deltemethrin or aemitaz 2 ml in 1 litre of water. ➤ Udder of milking animals must be properly clean with zinc oxide or boric powder.

PORBANDAR

Phone: 0285-2670139

Date: - 22-10-2019

(Period from 23 to 27 October 2019)

Weather forecast for Porbandar Dist. until 08:30 hrs of 27-10-2019

Parameters	Day-1 23-10-19	Day-2 24-10-19	Day-3 25-10-19	Day-4 26-10-19	Day-5 27-10-19
Rain fall (mm)	00	00	00	00	00
Maximum temperature °C	33	33	33	33	33
Minimum temperature °C	24	24	23	23	23
Cloud cover (Okta)	8	8	7	8	7
RH I % (Morning)	77	68	52	44	48
RH II % (After noon)	53	42	31	29	31
Wind speed (Km/h)	006	017	016	015	022
Wind direction(Deg)	94	43	43	46	64

Agro meteorological Advisories

General Advice	Rain fall Temperature RH (%) Wind Direction and Wind Speed		<p>There is forecasting of no rainfall occurs during on next five days.</p> <p>Maximum and minimum temperature likely to be in range of 33 °C and 23 - 24°C, respectively.</p> <p>The Relative Humidity is likely to be in the range of 77 – 29 %.</p> <p>Direction and speed of wind is likely to be E & mostly NE and 06– 22 km/h, respectively.</p>
Crop	Variety/ Pest / Insect	Stage	Agro met Advisories
			<p>❖ The sky will remain cloudy during next five days and no rainfall occurs during on next five days.</p> <p>❖ Farmers are advise to manage their</p>

			<p>harvesting & threshing of mature Kharif crops as per weather condition.</p> <ul style="list-style-type: none"> ❖ For pre-sowing of Kharif crops, harvesting operation should be carried out in time & make heap at safe place. ❖ The planning should be done for the sowing of <i>rabi</i> crops, procure certified seeds, fertilizers, chemicals and advances.
Kharif Groundnut	-	Pod Maturity / Harvesting	➤ Harvesting operation should be carried out at maturity stage.
Cotton	Sucking pest, Pink bollworm	Flowering / Boll formation	<ul style="list-style-type: none"> ➤ Interculturing and hand weeding should be carried out in cotton. ➤ Earthingup / ridging should be done in time. ➤ Install pink bollworm pheromone traps in the cotton field. OR spray 100 gm Beauveria bassiana powder and 20 ml prophenophos mix in 10 liter of water. ➤ For the control of Thrips and Jassid, spray 3 ml phosphamidon OR 15 ml dimethoate OR 15 ml methyl-O-demeton mix in 10 liter of water. ➤ When the cotton crop is three months, apply the supplementary fertilizer dose is 166.6 Urea kg/ha or 400 kg/ha Ammonium sulphate.
Soyabean	-	Harvesting	➤ Harvesting operation should be carried out at maturity stage.
Seasame	-	Harvesting	➤ Harvesting operation should be carried out at maturity stage.
Vegetable crops	-	Sowing/ Flowering/ Fruiting	➤ For the control of leaf webber in fruit leafy vegetable, sowing of trap crop (castor and galgota) around the vegetable crop. For the heavy incidence spray 10 ml methyl O

demeton (25 EC) Or 10 ml diamethoate (30 EC) in 10 liter of water.

- For the control of thrips and white fly, spray neem seed extract 500 ml or neem seed oil 50 or neem oil 40 ml and acetamiprid 20 % SP@ 5.0 gm / 10 lit of water at 15 days interval.
- For the control of thrips in chilli, spray 20 ml profenophos in 10 litres of water.
- For the control of fruit and shoot borer, spray neem seed extract 5 % or neem seed oil 50 ml and acetamiprid 20 % SP@ 5.0 gm / 10 lit of water at 15 days interval.
- Rouging of viral infested crop should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of 5 ml Imidacloprid per 10 litre of water is advised for control the vector, when sky remains clear.
- Apply regular irrigation at 6 to 8 days to the crop at the flowering and fruiting stage.
- In brinjal and tomato crops constant monitoring of borers by using pheromone traps 4-6 per acre is advised, for the control of fruit borer, spray renoxipayar @ 3.0ml in 10 lit of water.
- In brinjal and tomato crops, for the control of fruit fly, spray acetamiprid 5.0 ml in 10 lit of water.
- Keep vegetable crop weed free, apply irrigation regularly and send vegetable fruit to

			the market often grading.
Livestock	-	-	<ul style="list-style-type: none"> ➤ To provide adequate food and keep the animals clean shed. ➤ Spray phenyl in the animal shed to avoid flies and mosquitoes. ➤ Give stored fodder with mineral mixture. Fodder should be stored at safe place. ➤ Feed silage & hay material along with concentrate feed. ➤ Use chaff cutter for fodder. ➤ For the control of tick and other parasites, spray deltemethrin or aemitaz 2 ml in 1 litre of water. ➤ Udder of milking animals must be properly clean with zinc oxide or boric powder.

Gir Somnath

Phone: 0285-2670139

Date: - 22-10-2019

(Period from 23 to 27 October 2019)

Weather forecast for Gir Somnath Dist. until 08:30 hrs of 27-10-2019

Parameters	Day-1 23-10-19	Day-2 24-10-19	Day-3 25-10-19	Day-4 26-10-19	Day-5 27-10-19
Rain fall (mm)	08	00	00	00	00
Maximum temperature °C	32	33	34	34	34
Minimum temperature °C	26	25	24	23	23
Cloud cover (Okta)	8	8	8	8	8
RH I % (Morning)	77	75	66	50	59
RH II % (After noon)	68	57	46	38	39
Wind speed (Km/h)	011	023	022	021	022
Wind direction(Deg)	51	46	37	49	58

Agro meteorological Advisories

General Advice	Rain fall Temperature RH (%) Wind Direction and Wind Speed		<p>There is forecasting of light rainfall at isolated places during on tomorrow and no rainfall during on next four days.</p> <p>Maximum and minimum temperature likely to be in range of 32 - 34°C and 23 - 26°C, respectively.</p> <p>The Relative Humidity is likely to be in the range of 77 – 38 %.</p> <p>Direction and speed of wind is likely to be mostly NE and 11 – 23 km/h, respectively.</p>
Crop	Variety/ Pest / Insect	Stage	Agro met Advisories
			<ul style="list-style-type: none"> ➤ The sky will remain cloudy during next five days and light rainfall at isolated places during on tomorrow and no rainfall during on next four days.. ➤ Farmers are advise to manage their harvesting & threshing of mature Kharif crops as per weather condition. ➤ For pre-sowing of Kharif crops, harvesting operation should be carried out in time & make heap at safe place. ➤ The planning should be done for the sowing of <i>rabi</i> crops, procure certified seeds, fertilizers, chemicals and advances.
Kharif Groundnut	-	Pod Maturity / Harvesting	➤ Harvesting operation should be carried out at maturity stage.
Cotton	Sucking	Flowering /	➤ Interculturing and hand weeding should be carried out in cotton.

	pest, Pink bollworm	Boll formation	<ul style="list-style-type: none"> ➤ Earthingup / ridging should be done in time. ➤ Install pink bollworm pheromone traps in the cotton field. OR spray 100 gm Beauveria bassiana powder and 20 ml prophenophos mix in 10 liter of water. ➤ For the control of Thrips and Jassid, spray 3 ml phosphamidon OR 15 ml dimethoate OR 15 ml methyl-O-demeton mix in 10 liter of water. ➤ When the cotton crop is three months, apply the supplementary fertilizer dose is 166.6 Urea kg/ha or 400 kg/ha Ammonium sulphate.
Soyabean	-	Harvesting	<ul style="list-style-type: none"> ➤ Harvesting operation should be carried out at maturity stage.
Seasame	-	Harvesting	<ul style="list-style-type: none"> ➤ Harvesting operation should be carried out at maturity stage.
Castor	Semi looper	Vegetative	<ul style="list-style-type: none"> ➤ For the control of castor semi looper, spray 20 ml quinalphos (1.5 % powder) OR 40 gm carbaryl in 10 liter of water. ➤ Interculturing and hand weeding should be carried out in castor.
Black gram	-	Harvesting	<ul style="list-style-type: none"> ➤ Harvesting operation should be carried out at maturity stage.
Pigeon pea	-	Vegetative	<ul style="list-style-type: none"> ➤ Interculturing and hand weeding should be carried out in pigeon pea. ➤ Earthingup / ridging should be done in time.
Vegetable crops	-	Sowing/ Flowering/ Fruiting	<ul style="list-style-type: none"> ➤ For the control of leaf webber in fruit leafy vegetable, sowing of trap crop (castor and galgota) around the vegetable crop. For the heavy incidence spray 10 ml methyl O demeton (25 EC) Or 10 ml diamethoate (30 EC) in 10 liter of water.

			<ul style="list-style-type: none"> ➤ For the control of thrips and white fly, spray neem seed extract 500 ml or neem seed oil 50 or neem oil 40 ml and acetamidrid 20 % SP@ 5.0 gm / 10 lit of water at 15 days interval. ➤ For the control of thrips in chilli, spray 20 ml profenophos in 10 litres of water. ➤ For the control of fruit and shoot borer, spray neem seed extract 5 % or neem seed oil 50 ml and acetamidrid 20 % SP@ 5.0 gm / 10 lit of water at 15 days interval. ➤ Rouging of viral infested crop should be done in chilli. Infected plants should be uprooted and buried in the soil. After rouging, spraying of 5 ml Imidacloprid per 10 litre of water is advised for control the vector, when sky remains clear. ➤ Apply regular irrigation at 6 to 8 days to the crop at the flowering and fruiting stage. ➤ In brinjal and tomato crops constant monitoring of borers by using pheromone traps 4-6 per acre is advised, for the control of fruit borer, spray reanaxipayar @ 3.0ml in 10 lit of water. ➤ In brinjal and tomato crops, for the control of fruit fly, spray acetamidrid 5.0 ml in 10 lit of water. ➤ Keep vegetable crop weed free, apply irrigation regularly and send vegetable fruit to the market often grading.
Livestock	-	-	<ul style="list-style-type: none"> ➤ To provide adequate food and keep the

			<p>animals clean shed.</p> <ul style="list-style-type: none">➤ Spray phenyl in the animal shed to avoid flies and mosquitoes.➤ Give stored fodder with mineral mixture. Fodder should be stored at safe place.➤ Feed silage & hay material along with concentrate feed.➤ Use chaff cutter for fodder.➤ For the control of tick and other parasites, spray deltemethrin or aemitaz 2 ml in 1 litre of water.➤ Udder of milking animals must be properly clean with zinc oxide or boric powder.
--	--	--	--